



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૧૦/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૭૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૧ કેસ કરી, ૫૦ વ્યક્તિઓને ઝડપી, ૨૨૧ લીટર દેશી દારૂ, ૫૫ ઇંગ્લીશ દારૂ, ૧૮૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૧ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૨૧,૪૧૦/- કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૭૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૧૯૭૩/૧૮

ઈસનપુર: વિપુલભાઈ રતીલાલ શાહ (રહે, ઘનશ્યામનગર કેનાલ રોડ ઘોડાસર) એ તા.૮/૧૦/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૭/૧૮ બપોરના ૧૨/૦૦ થી તા.૨૭/૦૭/૧૮ સાજના ૪/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન જેટ હોલીડેઝ કંપનીના નામથી વિપુલભાઈ ને જુદા-જુદા મોબાઇલ નંબરો પરથી યોગેશ ચૌહાણ તથા વિનય ચોપડા તથા બેન્ક ઓફ મહારાષ્ટ્રના મેનેજર પીયુશ જૈન નામની વ્યક્તિઓએ ફોન કરી, વિપુલભાઈને હોલીડેઝ પેકેજની લોભામણી લાલચ આપી, www.jetholidays.co.in સાઇટ પર વિપુલભાઈએ હોલીડેઝ પેકેજ બુક કરાવતા, વિપુલભાઈને “લેપટોપ અને ઘડીયાળ ઇનામ રૂપે લાગેલ છે” તેવી લાલચ આપી www.jetholidays.co.in પરથી તેઓના ઇસ્ક્રીટીસ બેન્કના ખાતા નંબર-૧૦૦૦૦૩૭૨૩૦૨૫ માં જુદી-જુદી રકમો ભરાવી, વિપુલભાઈ પાસેથી કુલ રૂપિયા ૪,૪૬,૪૫૨/- ઓન-લાઇન તેમના કોટક મહીન્દ્રા બેન્કના ખાતામાંથી મેળવી લઈ, ઇન્ટરનેટ ફેસીલીટીનો દુરુપયોગ કરી વિપુલભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એમ.પટેલ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૯૭૪/૧૮

કૃષ્ણનગર: મનસુખભાઈ મોતીભાઈ ગેંડીયા (રહે, ચામુંડા સોસાયટી લાભ એપાર્ટમેન્ટની બાજુમાં જી.ડી હાઇસ્કૂલ રોડ સૈજપુર બોધા) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૧૦/૧૮ કલાક ૧૨/૪૫ વાગ્યાના સુમારે કૃષ્ણનગર હીરાવાડી મેડાવાલી ચાલી નજીક રોડ ઉપરથી એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ પુરૂષોએ મનસુખભાઈની એક્ટીવાના હુકમાં ભરાવેલ થેલીમાં રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- અને શેર કાગળો મુકેલ થેલી, મનસુખભાઈની નજર ચુકવી ચોરી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૯૭૫/૧૮

માધવપુરા: માધવપુરા મીલ બિલાડી કમ્પાઉન્ડ ઇદગાહ શ્રીજી સો ખાતે રહેતા અને ત્યાજ કામ કરતા કર્તલી વેક્ટરાવ માગુણી ચૌધરી (ઉ.વ.૪૫) એ અગમ્ય કારણસર તા.૦૮/૧૦/૧૮ કલાક ૧૦/૦૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન મીલના કારખાનામાં બીજા માળે આવેલ ઓરડીમાં છતના ભાગે લોખંડની એંગલ સાથે રૂમાલ બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી લાલજીભાઈ ચેહોરભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.